



November 20, 2020

To,
BSE Limited
The Deputy Manager (Listing - CRD)
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort
Mumbai - 400001
Scrp Code: 533151

The National Stock Exchange of India Limited
The Manager (Listing Department),
Exchange Plaza Block G, Bandra Kurla Complex
Bandra (East)
Mumbai - 400051
Symbol: DBCORP

Sub.: Newspaper advertisement for transfer of Equity Shares of D. B. Corp Limited ('the Company') to Investor Education and Protection Fund ('IEPF') Authority

**Ref.: 1. Regulation 30 read with the Schedule III and Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations'); and
2. ISIN: INE950I01011**

Dear Sir/ Madam,

Pursuant to Section 124 of the Companies Act, 2013 read with Rule 6 of IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and the aforesaid SEBI Listing Regulations, the Company has dispatched the individual notices on November 19, 2020 to those shareholders whose shares are liable to be transferred to IEPF Authority since the dividend has remained unpaid/ unclaimed on these shares for the past 7 (seven) consecutive years.

Further to the dispatch of such Reminder Notices, a 'Notice to the Shareholders' is published in the newspapers as prescribed in this regard in 'Financial Express' (English Newspaper) and 'Divya Bhaskar' (Gujarati Newspaper) on November 20, 2020. The copies of the said newspaper notices are enclosed herewith.

The said notices alongwith the list of shareholders whose shares are liable to be transferred to IEPF Authority are being made available on the Company's website at <https://www.dbcorpltd.com/> simultaneously.

You are requested to take the above information on your records.

Thanking you.

Yours truly,
For D. B. Corp Limited

Anita Gokhale
Company Secretary and Compliance Officer
Encl.: As above



Registered Office:
Plot No. 280, Sarkhej-Gandhinagar Highway,
Near YMCA Club, Makarba,
Ahmedabad - 380051.

Corporate Office:
501, 5th Floor, Naman Corporate Link,
Opp. Dena Bank, C-31, G Block,
Bandra Kurla Complex, Bandra (East), Mumbai-400051

CIN: L22210GJ1995PLC047208
Website: <http://dbcorpltd.com>
E-mail: dbcs@dbcorp.in
Tel: +91 22 7157 7000 • **Fax:** +91 22 7157 7093

Nippon India Mutual Fund
Wealth sets you free

Nippon Life India Asset Management Limited
(formerly known as Reliance Nippon Life Asset Management Limited)
(CIN - L65910MH1995PLC220793)

Registered Office: 4th Floor, Tower A, Peninsula Business Park,
Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013.
Tel No. +91 22 6808 7000 • Fax No. +91 22 6808 7097 • mf.nipponindiam.com

NOTICE CUM ADDENDUM NO. 86

Investors are requested to note that Nippon India Mutual Fund ("NIMF")/ Nippon Life India Asset Management Limited ("NAM India") has decided to make following changes in email addresses with immediate effect:

Existing Email Address	New Email Address
abc@nipponindiamf.com	abc@nipponindiam.in
xyz@nipponindiamc.com	xyz@nipponindiam.com

Accordingly all the existing email addresses (including but not limited to email addresses mentioned in Scheme Information Document (SID)/ Key Information Memorandum (KIM) of the Schemes of NIMF and Statement of Additional Information (SAI)) will undergo change as mentioned above, with immediate effect.

For example, the email address of Customer Service Centre "customer@nipponindiamf.com" will be changed to "customer@nipponindiam.in" and email address of Investor Relations Officer "bhalchandra.joshi@nipponindiamc.com" will be changed to "bhalchandra.joshi@nipponindiam.com".

This addendum forms an integral part of SID/KIM and SAI. Further, all the other terms and conditions of the aforesaid documents read with the addenda issued from time to time will remain unchanged.

For NIPPON LIFE INDIA ASSET MANAGEMENT LIMITED
(formerly known as Reliance Nippon Life Asset Management Limited)
(Asset Management Company for Nippon India Mutual Fund)

Mumbai November 19, 2020 Sd/-
Authorized Signatory

Make even idle money work! Invest in Mutual Funds

Mutual Fund investments are subject to market risks,
read all scheme related documents carefully.

PICTUREHOUSE MEDIA LIMITED

CIN: L92191TN2000PLC044077
Reg. Office: KRM Centre, 9th Floor, Door No. 2, Harrington Road, Chetpet, Chennai-600031, Tamil Nadu
Corp. Office: Plot No. 83 & 84, 4th Floor, Punniath Plaza, Road No. 2, Banjara Hills, Hyderabad - 500 034, Telangana
E-mail ID: ir.telephoto@pvpglobal.com; Website: www.pvpcinema.com

NOTICE OF 21st ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that:

- The 21st Annual General Meeting ("21st AGM") of the Company will be held on Friday, December 11, 2020 at 11.30 a.m through virtual Conference ("VC") / Other Audio Video Media ("OAVM"). In pursuant to the Ministry of Corporate Affairs ("MCA") circulars dated April 08, 2020 and April 13, 2020 read with circular dated May 05, 2020 permitted the holding of the Annual General Meeting through VC/OAVM meetings are permission in view of Covid -19 Pandemic.
- Electronic copies of the Notice of the 21st AGM and the Annual Report of the Company for the financial year 2019-20 have been sent to all the Members whose e-mail IDs are registered with the Company/ Depository Participant(s) on November 18, 2020.
- Members holding shares either in physical form or in dematerialised form, as on the cut-off date that i.e., December 04, 2020 may cast their vote electronically on the business as set out in the Notice of the 21st AGM through electronic voting system of KFin Technologies Private Limited other than "Istapoll" at the AGM.
 - the remote e-voting shall commence on Monday, December 07, 2020 at 9.00 a.m. (IST) and shall end on Thursday, December 10, 2020 at 5.00 p.m. (IST);
 - the remote e-voting shall not be allowed beyond 5.00 p.m. (IST) on December 10, 2020;
 - the cut-off date for determining the eligibility to vote by remote e-voting / instapollat AGM is December 04, 2020;
 - any person, who acquires shares of the Company and become Member of the Company after mailing of the Notice of AGM and holding shares as of the cut-off date i.e. Friday November 06, 2020, may obtain the login ID and password by sending a request at evoting@kfintech.com or ir.telephoto@pvpglobal.com. However, if a person is already registered with KFin Technologies Private Limited for e-voting, then existing user ID and password can be used for casting vote;
 - the Notice of the 21st AGM is available on the Company's website www.pvpcinema.com and KFin Technologies Private Limited website https://evoting.kfintech.com;
 - the facility of "instapoll" at the AGM is available who login virtual AGM;
 - the Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the Virtual AGM but shall not be entitled to cast their vote again;
 - a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date i.e., December 04, 2020 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM.;
 - in case of any queries, you may refer to Frequently Asked Questions (FAQs) and e-voting user manual for shareholders available at the download section of https://evoting.kfintech.com. Members may also contact Mr. Anandan. K., Manager, KFin Technologies Pvt. Ltd., Karvy Selenium, Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032 or at 040 67161500/2222 or at KFin's Toll Free No. 1-800-3454-001 or e-mail einward.ris@kfintech.com or contact the Company at ir.telephoto@pvpglobal.com.
- Pursuant to Section 91 of the Companies Act, 2013 and the applicable Rules thereunder, the Register of Members and Share Transfer Books for equity shares of the Company will remain closed from Monday, December 07, 2020 to Friday December 11, 2020 (both days inclusive), for the purpose of Annual General Meeting of the Company.
- We wish to reiterate that, the detailed instructions for attending the AGM VC/OVM is provided in the AGM Notice dated November 06, 2020. The said AGM Notice is available on the Company's website www.pvpcinema.com, on the Stock Exchange website of www.bseindia.com. Respectively and on the website of M/s. KFin Technologies Private Limited, Company at https://evoting.kfintech.com.

By order of the Board of Directors
for **PICTUREHOUSE MEDIA LIMITED**
Sd/-
Sajteja Ivaturi
Company Secretary & Compliance Officer

Date : November 19, 2020
Place : Hyderabad

MUTUAL FUNDS Sahi Hai

Indiabulls MUTUAL FUND

Investment Manager : Indiabulls Asset Management Co. Ltd. (AMC)
Registered Office: M - 62 & 63, 1st Floor, Connaught Place, New Delhi - 110 001.
Tel.: (011) - 30252900, Fax: (011) - 30252901, Website: www.indiabullsamc.com
CIN: U65991DL2008PLC176627

Notice cum Addendum No. 20/2020**Winding up of Indiabulls Ultra Short Term Fund, Under Regulation 39(2)(a) of SEBI (Mutual Funds) Regulations, 1996 :**

NOTICE is hereby given that pursuant to compliance of SEBI Circular No. Cir/IMD/DF/15/2014 dated June 20, 2014 read with Regulation 39(2)(a) of SEBI (Mutual Funds) Regulations 1996, Indiabulls Trustee Company Limited ("Trustee" of Indiabulls Mutual Fund) has decided to wind up Indiabulls Ultra Short Term Fund (Open ended debt scheme which invests in Debt & Money Market instruments such that the Macaulay duration of the portfolio is between 3 months - 6 months) (the Scheme) as the Scheme was not able to raise sufficient funds from the investors.

Pursuant to Regulation 41 (1) of SEBI (Mutual Funds) Regulations 1996, a meeting of the unit holders of the Scheme will be held on Monday, December 7, 2020 at 5:00 pm at 18th Floor, Tower 1, One International Centre, Prabhadevi (W), Mumbai - 400 013 to transact the following business:

"To approve by simple majority of the unit holders present and voting at the meeting, a resolution for authorizing the Trustees or any other person so authorized by the Trustee to take steps for winding up of the Scheme".

In pursuance to Regulation 40 of the SEBI (Mutual Funds) Regulations, 1996, with effect from close of business hours of November 23, 2020 Indiabulls Asset Management Company Limited shall:

- cease to carry on any business activity in respect of the Scheme;
- cease to create or cancel units in the Scheme;
- cease to issue or redeem units in the Scheme.

The Trustee or the person so authorized will dispose-off the assets of the Scheme in the best interest of the unitholders. The sales proceeds after discharge of all liabilities and expenses will be paid to the unitholders in proportion to their respective interest in the assets of the Scheme. In the meanwhile, in reference to SEBI Circular no SEBI/HO/IMD/DF3/CIR/P/2020/086 dated May 20, 2020, upon unitholders approval to wind-up the scheme, AMC shall initiate the listing process, whereby the units shall be made available for trading at the recognized stock exchange in dematerialized form. Unitholders may update their demat account number through account update form to facilitate the transfer of their units held in electronic form (Statement of Account) to dematerialized form.

Accordingly, investment of unitholders whose names appear on the register of unitholders maintained by the Fund/Statement of beneficial ownership maintained by the Depositories at the close of business hours on November 23, 2020, shall be entitled to attend and vote at the meeting. If none of the units holder(s) are present at the meeting, the Trustee or the person so authorized shall assume the authority to take steps for winding up of the Scheme. Individual communication is being dispatched to the unitholder (s) disclosing the circumstances leading to the winding up of the Scheme.

Intimation of any change of address/ bank details should be immediately forwarded to the Investor Services Centers of the Fund. For any queries or clarification in this regards, please email us on customer@indiabullsamc.com.

As per the Go Green Initiative, investors are encouraged to register/update their email id and mobile number with us to support paper less communications.

For Indiabulls Asset Management Co. Ltd.
(Investment Manager to Indiabulls Mutual Fund)
Sd/-
Uday Diwale
Compliance Officer
Place : Mumbai
Date : November 19, 2020

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

MUTUAL FUNDS Sahi Hai

Indiabulls MUTUAL FUND

Investment Manager : Indiabulls Asset Management Co. Ltd. (AMC)
Registered Office: M - 62 & 63, 1st Floor, Connaught Place, New Delhi - 110 001.
Tel.: (011) - 30252900, Fax: (011) - 30252901, Website: www.indiabullsamc.com
CIN: U65991DL2008PLC176627

Notice cum Addendum No. 18/2020**Winding up of Indiabulls Income Fund, Under Regulation 39(2)(a) of SEBI (Mutual Funds) Regulations, 1996 :**

NOTICE is hereby given that pursuant to compliance of SEBI Circular No. Cir/IMD/DF/15/2014 dated June 20, 2014 read with Regulation 39(2)(a) of SEBI (Mutual Funds) Regulations 1996, Indiabulls Trustee Company Limited ("Trustee" of Indiabulls Mutual Fund) has decided to wind up Indiabulls Income Fund (Medium Duration open ended debt scheme investing in Debt & Money Market instruments such that the Macaulay duration of the portfolio is between 3 - 4 years) (the Scheme) as the Scheme was not able to raise sufficient funds from the investors.

Pursuant to Regulation 41 (1) of SEBI (Mutual Funds) Regulations 1996, a meeting of the unit holders of the Scheme will be held on Monday, December 7, 2020 at 1:00 pm at 18th Floor, Tower 1, One International Centre, Prabhadevi (W), Mumbai - 400 013 to transact the following business:

"To approve by simple majority of the unit holders present and voting at the meeting, a resolution for authorizing the Trustees or any other person so authorized by the Trustee to take steps for winding up of the Scheme".

In pursuance to Regulation 40 of the SEBI (Mutual Funds) Regulations, 1996, with effect from close of business hours of November 23, 2020 Indiabulls Asset Management Company Limited shall:

- cease to carry on any business activity in respect of the Scheme;
- cease to create or cancel units in the Scheme;
- cease to issue or redeem units in the Scheme.

The Trustee or the person so authorized will dispose-off the assets of the Scheme in the best interest of the unitholders. The sales proceeds after discharge of all liabilities and expenses will be paid to the unitholders in proportion to their respective interest in the assets of the Scheme. In the meanwhile, in reference to SEBI Circular no SEBI/HO/IMD/DF3/CIR/P/2020/086 dated May 20, 2020, upon unitholders approval to wind-up the scheme, AMC shall initiate the listing process, whereby the units shall be made available for trading at the recognized stock exchange in dematerialized form. Unitholders may update their demat account number through account update form to facilitate the transfer of their units held in electronic form (Statement of Account) to dematerialized form.

Accordingly, investment of unitholders whose names appear on the register of unitholders maintained by the Fund/Statement of beneficial ownership maintained by the Depositories at the close of business hours on November 23, 2020, shall be entitled to attend and vote at the meeting. If none of the units holder(s) are present at the meeting, the Trustee or the person so authorized shall assume the authority to take steps for winding up of the Scheme. Individual communication is being dispatched to the unitholder (s) disclosing the circumstances leading to the winding up of the Scheme.

Intimation of any change of address/ bank details should be immediately forwarded to the Investor Services Centers of the Fund. For any queries or clarification in this regards, please email us on customer@indiabullsamc.com.

As per the Go Green Initiative, investors are encouraged to register/update their email id and mobile number with us to support paper less communications.

For Indiabulls Asset Management Co. Ltd.
(Investment Manager to Indiabulls Mutual Fund)
Sd/-
Uday Diwale
Compliance Officer
Place : Mumbai
Date : November 19, 2020

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

MUTUAL FUNDS Sahi Hai

Indiabulls MUTUAL FUND

Investment Manager : Indiabulls Asset Management Co. Ltd. (AMC)
Registered Office: M - 62 & 63, 1st Floor, Connaught Place, New Delhi - 110 001.
Tel.: (011) - 30252900, Fax: (011) - 30252901, Website: www.indiabullsamc.com
CIN: U65991DL2008PLC176627

Notice cum Addendum No. 17/2020**Winding up of Indiabulls Banking & PSU Fund, Under Regulation 39(2)(a) of SEBI (Mutual Funds) Regulations, 1996 :**

NOTICE is hereby given that pursuant to compliance of SEBI Circular No. Cir/IMD/DF/15/2014 dated June 20, 2014 read with Regulation 39(2)(a) of SEBI (Mutual Funds) Regulations 1996, Indiabulls Trustee Company Limited ("Trustee" of Indiabulls Mutual Fund) has decided to wind up Indiabulls Banking & PSU Fund (Open ended debt scheme with minimum investment in Debt instruments of banks, Public Sector Undertakings, Public Financial Institutions-80% of total assets) (the Scheme) as the Scheme was not able to raise sufficient funds from the investors.

Pursuant to Regulation 41 (1) of SEBI (Mutual Funds) Regulations 1996, a meeting of the unit holders of the Scheme will be held on Monday, December 7, 2020 at 3:00 pm at 18th Floor, Tower 1, One International Centre, Prabhadevi (W), Mumbai - 400 013 to transact the following business:

"To approve by simple majority of the unit holders present and voting at the meeting, a resolution for authorizing the Trustees or any other person so authorized by the Trustee to take steps for winding up of the Scheme".

In pursuance to Regulation 40 of the SEBI (Mutual Funds) Regulations, 1996, with effect from close of business hours of November 23, 2020 Indiabulls Asset Management Company Limited shall:

- cease to carry on any business activity in respect of the Scheme;
- cease to create or cancel units in the Scheme;
- cease to issue or redeem units in the Scheme.

The Trustee or the person so authorized will dispose-off the assets of the Scheme in the best interest of the unitholders. The sales proceeds after discharge of all liabilities and expenses will be paid to the unitholders in proportion to their respective interest in the assets of the Scheme. In the meanwhile, in reference to SEBI Circular no SEBI/HO/IMD/DF3/CIR/P/2020/086 dated May 20, 2020, upon unitholders approval to wind-up the scheme, AMC shall initiate the listing process, whereby the units shall be made available for trading at the recognized stock exchange in dematerialized form. Unitholders may update their demat account number through account update form to facilitate the transfer of their units held in electronic form (Statement of Account) to dematerialized form.

Accordingly, investment of unitholders whose names appear on the register of unitholders maintained by the Fund/Statement of beneficial ownership maintained by the Depositories at the close of business hours on November 23, 2020, shall be entitled to attend and vote at the meeting. If none of the units holder(s) are present at the meeting, the Trustee or the person so authorized shall assume the authority to take steps for winding up of the Scheme. Individual communication is being dispatched to the unitholder (s) disclosing the circumstances leading to the winding up of the Scheme.

Intimation of any change of address/ bank details should be immediately forwarded to the Investor Services Centers of the Fund. For any queries or clarification in this regards, please email us on customer@indiabullsamc.com.

As per the Go Green Initiative, investors are encouraged to register/update their email id and mobile number with us to support paper less communications.

For Indiabulls Asset Management Co. Ltd.
(Investment Manager to Indiabulls Mutual Fund)
Sd/-
Uday Diwale
Compliance Officer
Place : Mumbai
Date : November 19, 2020

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

DB Corp Ltd

Registered Office: Plot No. 280, Sarkhej-Gandhinagar Highway,
Near YMCA Club, Makarba, Ahmedabad - 380 051, Gujarat. Tel: +91 22 7157 7000
Email: dbcs@dbcorp.in • Website: www.dbcorppltd.com • CIN: L22210GJ1995PLC047208

NOTICE FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF THE COMPANY
Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund ("IEPF") Authority

Notice is hereby given pursuant to Section 124 of the Companies Act, 2013 ("the Act") and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time read with the relevant circulars and amendments thereto ("the Rules").

The Rules, inter-alia, provides that the shares in respect of which the dividend has remained unpaid or unclaimed for a period of seven consecutive years or more, are to be transferred to the DEMAT Account of the IEPF Authority.

In terms of the said Rules, interim dividend declared by D. B. Corp Limited (the 'Company') for the financial year 2013-14 which has remained unpaid or unclaimed for a period of 7 (seven) years will be credited to the account of IEPF Authority on the due date. Also, underlying shares on which such dividend has remained unpaid or unclaimed for 7 (seven) consecutive years will also be transferred to the IEPF Authority in February, 2021.

However, the Company will not transfer such shares where there is a specific order of Court or Tribunal or any other statutory authority restraining any transfer of shares and payment of dividend or where such shares are pledged or hypothecated under the provisions of the Depositories Act, 1996.

In compliance with the requirements of the said Rules, the Company has, vide its letter dated November 19, 2020, communicated individually to all those shareholders whose shares are liable to be transferred to the IEPF Authority in the month February, 2021, at their registered addresses. The Company has also uploaded full details of those shareholders on its website at www.dbcorppltd.com. Shareholders are requested to refer to the aforesaid website to verify the details of unclaimed dividends and the shares which are liable to be transferred to the IEPF Authority and thereafter contact the Company for making a valid claim in respect of such unclaimed dividend and the underlying shares.

In case the Company does not receive any communication from these shareholders by February 13, 2021, the Company shall, with a view to complying with the requirements set out in the Act and the Rules, transfer the shares to IEPF Authority on the due date as per procedure stipulated in the Rules without giving further notice, in the following manner:

In respect of shares held in Physical Form	The Company shall issue new share certificates in lieu of the original share certificates held by the concerned shareholders for the purpose of dematerialisation by way of corporate action and transfer of shares to IEPF Authority as per the Rules and upon such issue, the original share certificates which stand registered in the name of concerned shareholder will stand automatically cancelled and be deemed to be non-negotiable.
In respect of shares held in Dematerialised Form	The Company shall inform the depository to transfer the said shares in favour of DEMAT account of IEPF Authority by way of corporate action.

The concerned shareholders are requested to note that no liability shall lie against the Company in respect of the unclaimed dividend amount and the underlying shares so transferred. The concerned shareholders may also note that both the unclaimed dividend and the underlying shares transferred to IEPF Authority including all benefits accruing on such shares, if any, except the right shares can be claimed back by the concerned shareholders from IEPF Authority after following the procedure prescribed under the Rules which is displayed on the website www.iepf.gov.in.

For any queries / information / clarification in the subject matter, shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents M/s. KFin Technologies Private Limited, Unit: D. B. Corp Limited, Selenium Tower B, Plot 31-32, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Hyderabad - 500 032 Phone: +91 40 67161563 1 Toll free number: 1800 345 4001 Email id: einward.ris@kfintech.com (K.A. Ms. Shobha Anand, Deputy General Manager) or may write to Ms. Anita Gokhale, Company Secretary by sending Email to dbcs@dbcorp.in.

For D. B. Corp Ltd.
Sd/-
Anita Gokhale
Company Secretary

Place: Mumbai
Date: November 19, 2020

ICICI Prudential Asset Management Company Limited
Corporate Identity Number: U99999DL1993PLC054135

To increase awareness about Mutual Funds, we regularly conduct Investor Awareness sessions across the country. Schedule for upcoming "Chat Show" webinar is as below:

Date	Time	For Registration
21 st November, 2020	5 p.m. onwards	https://bit.ly/ICICIPRUB

Mutual Fund investments are subject to market risks,
read all scheme related documents carefully.

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

एण्ड्रयू यूल एण्ड कम्पनी लिमिटेड
ANDREW YULE & COMPANY LIMITED
(A Government of India Enterprise)
CIN: L63090WB1990I003229

Registered Office: "Yule House", B. Dr. Rajendra Prasad Sarani,
Kolkata-700 001. Ph.: 033 2242-8210 / 8550, Fax No.: 033 2242-8778
E-mail: com.sec@andrewyule.com; Website: www.andrewyule.com

ADDENDUM TO THE NOTICE OF 72ND ANNUAL GENERAL MEETING
Notice is hereby given that due to unavoidable reasons, the ensuing 72nd Annual General Meeting (AGM) of the members of Andrew Yule & Company Limited scheduled to be held on Wednesday, the 25th day of November, 2020 at 11.00 a.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") vide Company's notice dated 21st October, 2020 sent to the members of the Company together with Annual Report for FY 2019-20 on 3rd November, 2020 through electronic mode, will now be held on Wednesday, the 25th day of November, 2020 at 3.30 p.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"). Members of the Company are hereby informed to attend the ensuing 72nd AGM of the Company at the revised time i.e. Wednesday, the 25th day of November, 2020 at 3.30 p.m. The other points will remain the same.

For Andrew Yule & Company Limited
Sd/-
(Sucharita Das)
Company Secretary

Place : Kolkata
Date : 20th November, 2020

VIKAS PROPPANT & GRANITE LIMITED

Corporate Office: F-88/89, Udhog Vihar, RIICO Industrial Area, Sriganaganagar-335002 (Rajasthan)
CIN: L14100HR1994PLC036433
Registered Office: Hisar Road, Siwani - 127046 (Haryana)
Telephone: 0154-2491319. Fax: 0154-2494361
Email id: office@vikasgranarians.in;
Visit our Web Site: www.vpgil.in or www.vikasproppantandgraniteltd.in

NOTICE
Notice is hereby given, Pursuant to regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015 ("Listing Regulations") that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Wednesday, November 25, 2020 at 03:30 P.M.** at its Corporate Office i.e. F-88/89, Udhog Vihar, RIICO, Sri Ganganagar - 335002, inter-alia, to consider & approve the unaudited financial results of the company for half year ended September 30th, 2020.

By order of the Board
Vikas Proppant & Granite Limited
Sd/-
(Kamini Jindal)
Director

Date : 19/11/2020
Place : Sri Ganganagar

Hero MotoCorp Limited
Regd. Office: The Grand Plaza, Plot No. 2, Nelson Mandela Road, Vasant Kunj - Phase-II, New Delhi - 110070
CIN: L35911DL1984PLC017354 | Phone: 011-46044220
Fax: 011-46044399 | E-mail: secretarial@heromotocorp.com
Website: www.heromotocorp.com

PUBLIC NOTICE FOR ISSUE OF DUPLICATE SHARE CERTIFICATES
Members of the general public and existing shareholders of Hero MotoCorp Ltd. ("Company") are hereby informed that the Original Share Certificates, details of which are given hereunder have been reported lost/stolen/damaged/not received and that pursuant to requests received from concerned shareholders, the Company intends to issue duplicate share certificates in lieu of the said original Share Certificates (Face Value Rs.2/-) in their favour :

Folio No.	Shareholders Name	Face Value	Distinctive Nos.	Certificate No.(s)	No. of Shares
HML0098486	SUNIL HASHMUKHLAL PATEL	Rs.10/-	18588948-18588967	256144	20
HML0119058	MAHENDRA BANSILAL SHAH	Rs.2/-	159915871-159916490	517497	620
		Rs.10/-	1433766-1433815	28885	50
			19134789-19134798	277805	10
			19134799-19134800	277806	02
			33291656-33291705	367603	50
			33291706-33291717	367604	12

Any person having objections to issue of duplicate Share Certificates, as mentioned herein above, may submit the same, in writing, with the Company marked to the 'Secretarial Department' at its Registered Office or send an email at secretarial@heromotocorp.com within 7 days from the date of publication of this Notice. In the meanwhile, members of the public are hereby cautioned against dealing in the above mentioned Share Certificates.

For Hero MotoCorp Ltd.
Sd/-
Neerja Sharma
Company Secretary & Chief Compliance Officer

Place : New Delhi
Date : 19/11/2020

INDIA FINSEC LIMITED
Regd. Off.: D-16, First Floor, Above ICICI Bank, Prashant Vihar, Sector-14, Rohini, Delhi-110085
CIN: L65923DL1994PLC060827
PH. NO: 011-4709097
E-Mail: indiafinsec@gmail.com
Website: www.indiafinsec.com

Corrigendum to the Un-audited Consolidated and Standalone Financial Results for the quarter/half year ended September, 2020 Published on 14/11/2020
There were some mistakes in the Un-audited Financial Results for the Quarter & Half Year Ended 30.09.2020 of INDIA FINSEC LIMITED, published on 14.11.2020, in Financial Express (English, All Editions) & Jansatta (Hindi, Delhi). In the CONSOLIDATED Financial Results, the Figure for the Half Year Ended on 30.09.2020, the Net Profit for the period after tax in row no. 4 was mentioned as Rs. 327.59 Lakh instead of Rs. 232.05 Lakh and Total Comprehensive Income mentioned in row no. 5 as Rs. 381.26 Lakh instead of Rs. 265.72 Lakh. Further, the Earning Per share data mentioned in Row No. 8 as Rs. 1.31 (Basic) and Rs. 1.31 (Diluted) instead of Rs. 0.93 (Basic) and Rs. 0.93 (Diluted). Rest matters are same. The error is regretted.

For India Finsec Limited
Place: New Delhi
Date: 19.11.2020
Gopal Bansal
(Chairman & Managing Director)
DIN: 01246420

